

Voltamp Transformers Limited

May 05, 2025

To,
National Stock Exchange of India Limited,
Listing Department,
Exchange Plaza,
Bandra Kurla Complex, Bandra,
Mumbai – 400 051.

To,
BSE Limited,
Dept. of Corporate Services,
Floor – 1, Rotunda Building,
P J Towers, Dalal Street,
Mumbai – 400 001.

Scrip Code: VOLTAMP

Script Code: 532757

Subject: Newspaper publication of Audited Financial Results

We are enclosing herewith the extracts of the Audited Financial Results of the Company for the quarter and year ended March 31, 2025, published on Monday, May 05, 2025, in “Business Standard” (English Newspaper) and “Vadodara Samachar” (Gujarati Newspaper).

Kindly take the same on your records.

Thank You.

Yours faithfully,
For Voltamp Transformers Limited

Sanket Rathod
Company Secretary & Compliance Officer
Encl. A/a.

Regd. Office & Works: Makarpura, Vaddara-3900 14, Gujarat, India **Phone :** + 91 265 6 141403-480, 3041403-480, +91 8 128675078 , 8128675080
Fax : + 91 - 265 6141499 , 304 1499 **Email :** voltamp@voltamptransformers.com **Web :** www.voltamptransformers.com **CIN :** L31100GJ1967PLC001437

Branches:

Ahmedabad / Bangalore / Bhubaneshwar / Chandigarh / Chennai / Coimbatore / Guwahati / Jaipur / Jamshedpur / Kolkata / Mumbai / Nagpur / New Delhi / Pune / Secunderabad

PSBs’ bancassurance growth slows amid core banking push

FM, ex-Irdai chairman had raised concerns over misselling

AATHIRA VARIER
Mumbai, 4 May

Amid growing concerns about mis-selling through the bancassurance (banca) channel, public-sector banks (PSBs) have scaled back their insurance sales efforts, leading to a slowdown in growth through banca for life insurance companies in 2024-25 (FY25).
In contrast, life insurance companies affiliated with private-sector banks have nearly doubled their growth through the banca channel

in the same period.
According to industry estimates, growth in the banca channel of life insurers backed by PSBs slowed from 7 per cent in FY24 to 6 per cent in FY25, with growth in March slowing to just 2 per cent.
Banca channel growth for life insurers with private banks was healthy at 15 per cent in FY25. But in March, growth was only 7 per cent. In the previous financial year, growth through this channel was 8 per cent.
“There is a marginal drop in growth of PSB-led insurance companies due to (a) slowdown in PSB banca business, owing to changes



in incentive schemes and scorecards for bank employees for selling insurance,” said a chief executive officer of a private life insurer.
“State-owned banks do not really have a concept of incentives for their employees directly for selling insurance products. However, earlier there were some banks that were giving considerable commissions or some rewards along with other incentives. Now, they have totally stopped it.
Moreover, the Reserve Bank of India has asked banks to focus more on their core business and insurance is more of our customer service business. This is likely to have resulted in

TUMULTUOUS PHASE
■ In FY25, growth in banca channel life insurance sales was in low single digits for some PSBs

■ However, this growth was healthier at 15% for private banks

■ Slowdown partly attributed to changes in incentive structures for public sector bankers

■ Moreover, many customers are switching to online purchase of policies

some slowdown,” said a senior PSB official.
Banca channel growth for some PSBs, including Punjab National

Bank, Canara Bank, and Union Bank of India in FY25 was in low single digits. For State Bank of India (SBI), Bank of Baroda, and Bank of India, it was in double digits.
This comes after Finance Minister Nirmala Sitharaman and former Insurance Regulatory and Development Authority of India (Irdai) Chairman Deboshish Panda flagged concerns about misselling of insurance products by banks at the SBI Conclave in November 2024. Irdai had also formed a task force to review the banca framework amid complaints of misselling and forced-selling.
At the conclave, the finance minister had asked bankers to focus on their core business and avoid mis-

selling insurance policies, pointing out that many a time, this also indirectly increases the cost of borrowing for bank customers.
According to a bank official, some PSBs have realigned their strategies and are now focusing on core business. They have also reduced certain incentives offered to their employees. Although generally, commission for added services like insurance and mutual funds are offered to banks, some lenders used to give incentives to employees which has been changed.
According to another insurance official, there has been a slowdown in the banca business of PSBs in the past one-and-a-half years

because footfall in banks has come down as customers prefer to buy insurance online.
“We have to find a digital solution to counter it. The banks have put checks and balances, including video PIVC (pre-insurance verification call) to prevent misselling. Banks have undergone changes to counter misselling concerns,” the official said.
According to analysts, if distribution by bank partners slows, smaller insurance companies will have to diversify to other channels while the bigger bank-led insurance companies already have a diversified channel mix.

(With inputs from Subrata Panda)



VODAFONE IDEA LIMITED

CIN: L32100GJ1996PLC030976
Registered Office: Suman Tower, Plot No. 18, Sector-11, Gandhinagar - 382 011, Gujarat
Email: shs@vodafoneidea.com Website: www.myvi.in
Tel: +91-79-66714000 Fax: +91-79-23232251

NOTICE OF THE EXTRAORDINARY GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCE (VC) / OTHER AUDIO VISUAL MEANS (OAVM)

NOTICE is hereby given that an Extraordinary General Meeting ('EGM') of the Company will be held on **Tuesday, June 3, 2025 at 4:30 p.m. (IST)** through Video Conferencing ('VC') / Other Audio Visual Means ('OAVM') to transact the businesses that will be set forth in the Notice of EGM ('Notice').

The EGM is convened in compliance with applicable provisions of the Companies Act, 2013 and the rules made thereunder ('Act'); provisions of the Securities and Exchange Board of India ("SEBI") (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('Listing Regulations') and the provisions of General Circular No. 09/2024 dated September 19, 2024, other circulars issued by Ministry of Corporate Affairs from time to time and Circular No. SEBI/HO/CFD/CFDPoD-2/P/CIR/2024/133 dated October 3, 2024 issued by SEBI, without the physical presence of the Members at a common venue.

In accordance with the MCA Circulars, the Notice will be sent only through electronic mode to those members whose e-mail ids are registered with the Company/Depository Participants (DPs). The Notice will also be available on the website of the Company at www.myvi.in, websites of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively. Further, members can join and participate in the EGM through VC/OAVM facility only. The instructions for joining and manner of participation in the EGM will be provided in the Notice. Members attending the EGM through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

Members holding shares in physical form and who have not yet registered / updated their e-mail id with the Company are requested to register / update their e-mail id with Bigshare Services Pvt. Ltd. by sending requests at investor@bigshareonline.com with details of folio number and attaching a self-attested copy of PAN card and self-attested copy of any other document (e.g. Driving License, Passport, Aadhar Card etc.) in support of address of the members or by logging onto <https://www.bigshareonline.com/InvestorLogin.aspx>.

Members holding shares in dematerialised mode are requested to register / update their e-mail id with their respective Depository Participant(s).

The Company will provide remote e-voting facility to all its members to cast their votes on the resolutions set forth in the Notice. Additionally, the Company will provide the facility of voting through e-voting system during the EGM. The detailed procedure for casting votes through remote e-voting at the EGM shall be provided in the Notice.

This advertisement is being issued for the information and benefit of all the members of the Company in compliance with the MCA Circulars.

For Vodafone Idea Limited

Sd/-

Pankaj Kapdeo
Company Secretary

Place: Mumbai

Dated : May 5, 2025



VOLTAMP TRANSFORMERS LIMITED


Registered office : Makarpura, Vadodara – 390014, Gujarat.
CIN : L31100GJ1967PLC001437
Tel: 0265 6141403 / 6141480 / 3041480 | Email: sanket_act@voltamtransformers.com
Website: www.voltamtransformers.com

EXTRACT OF STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2025

(Rs.in Lakhs)						
Sr. No.	Particulars	Quarter ended 31/03/2025 (Audited)	Quarter ended 31/12/2024 (Unaudited)	Quarter ended 31/03/2024 (Audited)	Year ended 31/03/2025 (Audited)	Year ended 31/03/2024 (Audited)
1	Total income from operations (net)	62481.43	48352.28	50415.98	193423.03	161622.27
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	12933.80	10217.42	11938.10	43630.31	39787.65
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	12933.80	10217.42	11938.10	43630.31	39787.65
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	9682.55	7340.24	9352.94	32541.32	30736.07
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	9667.68	7333.46	9288.27	32506.12	30708.96
6	Paid up Equity Share Capital (face value of Rs.10 each)	1011.71	1011.71	1011.71	1011.71	1011.71
7	Reserves (excluding Revaluation Reserve)	----	----	----	157750.30	134349.59
8	Earnings Per Share (not annualised)					
	Basic :	95.70	72.55	92.45	321.65	303.80
	Diluted :	95.70	72.55	92.45	321.65	303.80

Notes:-

- The above audited results for quarter and year ended March 31, 2025 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meeting held on Saturday, May 03, 2025.
- Segment reporting as defined in IND-AS 108 is not applicable, since the Company has only one reporting segment i.e. Manufacturing of Electrical Transformers.
- The above is an extract of the detailed format of Quarter and year ended March 31, 2025 Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly & year ended Financial Results are available on the Company's website at www.voltamtransformers.com and on the website of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com. The same can be accessed by scanning the QR code provided below.



FOR VOLTAMP TRANSFORMERS LIMITED


Kunjai L Patel

(DIN:00008354)

Vice Chairman & Managing Director

Date: May 03, 2025

Place: Vadodara



VARDHMAN TEXTILES LIMITED

Delivering Excellence. Since 1965.

Regd. Office : Chandigarh Road, Ludhiana-141 010.
CIN: L17111PB1973PLC003345
Website: www.vardhman.com, Email: secretarial.lud@vardhman.com

Consolidated Audited Financial Results for the quarter and year ended March 31, 2025


(Rs. in Crores)						
Sr. No.	Particulars	Quarter Ended March 31, 2025 Unaudited	Quarter Ended Dec. 31, 2024 Unaudited	Quarter Ended March 31, 2024 Unaudited	Year Ended March 31, 2025 Audited	Year Ended March 31, 2024 Audited
1	Total Income from Operations	2,628.54	2,533.70	2,526.56	10,120.84	9,830.62
2	Net Profit/(Loss) for the period (before Tax, Non controlling interest and Share of Profit/(Loss) of Associates and Exceptional items)	280.45	261.54	250.03	1,120.51	792.28
3	Net Profit/(Loss) for the period before tax, Non controlling interest and Share of Profit/(Loss) of Associates (after Exceptional items)	280.45	261.54	250.03	1,120.51	792.28
4	Net Profit/(Loss) for the period after tax, Non controlling interest and Share of Profit/(Loss) of Associates (after Exceptional items)	237.31	210.61	200.59	883.27	631.59
5	Total Comprehensive Income/ (Expenditure) for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income/ (Expenditure) (after tax)]	238.13	210.63	204.49	884.13	635.42
6	Paid-up Equity Share Capital	56.90	56.90	56.90	56.90	56.90
7	Reserves (excluding Revaluation Reserve & Non controlling interest)	9,839.12	9,581.14	9,043.23	9,839.12	9,043.23
8	Earnings Per Share (in Rs.) (not annualized):					
	(a) Basic	8.35	7.40	7.05	31.05	22.20
	(b) Diluted	8.35	7.40	7.05	31.05	22.20

NOTES :

- The above is an extract of the detailed format of quarterly and annual financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly and annual financial results are available on the Stock Exchanges websites i.e. www.bseindia.com and www.nseindia.com and also on website of the company i.e. <https://www.vardhman.com/Investors/FinancialReports>.
- The Financial Results has been prepared in accordance with the Indian Accounting Standards (Ind AS) as prescribed under Section 133 of the Companies Act, 2013 read with Rule 3 of Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended and requirements of Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 as amended.
- The Board of Directors has recommended a dividend of Rs. 5 per share on fully paid up equity shares of the Company.
- Financial results of Vardhman Textiles Limited (Standalone Information) :** (Rs. in Crores)

Sr. No.	Particulars	Quarter Ended March 31, 2025 Unaudited	Quarter Ended Dec. 31, 2024 Unaudited	Quarter Ended March 31, 2024 Unaudited	Year Ended March 31, 2025 Audited	Year Ended March 31, 2024 Audited
1	Total income from operations	2,578.08	2,476.65	2,477.73	9,954.68	9,632.22
2	Profit before tax	282.09	263.87	243.68	1,149.69	790.98
3	Net Profit after tax	228.97	203.56	186.63	879.07	607.63
4	Total Comprehensive Income/ (Expenditure)	229.95	203.56	190.44	880.05	611.44

The aforementioned Financial Results alongwith the Audit Report of the Statutory Auditors thereon can also be accessed by scanning a Quick Response Code given below:



For Vardhman Textiles Limited

Sd/-


S.P. Oswal
Chairman & Managing Director

Place : Ludhiana

Dated : May 03, 2025

JM FINANCIAL SERVICES LIMITED

Corporate Identity Number : U67120MH1998PLC115415
Regd. Office : 7th Floor, Cnergy, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai 400 025.
Tel. No.: +91 22 6630 3030 • Fax No.: +91 22 6630 3223
Email: AmitT.Agrawal@jmfli.com • Website: www.jmfinancialservices.in



STATEMENT OF STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2025

(₹ in Lakhs)						
Sr. No.	Particulars	STANDALONE		CONSOLIDATED		
		Quarter Ended		Financial Year Ended		Financial Year Ended
		March 31, 2025	March 31, 2024	March 31, 2025	March 31, 2024	March 31, 2025
		Unaudited	Unaudited	Audited	Audited	Audited
1	Total Income from Operations	28,399.25	28,593.15	1,13,994.90	91,986.51	1,17,194.29
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items#)	3,174.27	6,234.77	14,086.25	13,031.20	15,377.34
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items#)	3,174.27	6,234.77	14,086.25	13,031.20	15,377.34
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items#)	2,333.26	4,951.62	10,881.12	10,224.29	11,098.99
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	2,282.58	4,957.23	10,730.97	10,210.30	10,948.66
6	Paid up Equity Share Capital	6,632.50	6,632.50	6,632.50	6,632.50	6,632.50
7	Reserves (excluding Revaluation Reserve)	82,216.24	71,015.78	82,216.24	71,015.78	82,800.92
8	Securities Premium Account	24,431.00	24,431.00	24,431.00	24,431.00	24,431.00
9	Net worth	89,798.74	78,598.28	89,798.74	78,598.28	90,468.76
10	Paid up Debt Capital / Outstanding Debt	2,21,363.51	2,00,285.06	2,21,363.51	2,00,285.06	3,08,992.51
11	Outstanding Redeemable Preference Shares	—	—	—	—	—
12	Debt Equity Ratio	2.47	2.55	2.47	2.55	3.42
13	Earnings Per Share of ₹ 10/- each (for continuing and discontinued operations)					
	1. Basic: (₹) (Not annualised)	3.08	6.73	14.35	14.91	14.64
	2. Diluted: (₹) (Not annualised)	3.05	6.69	14.24	14.81	14.53
14	Capital Redemption Reserve	468.75	468.75	468.75	468.75	868.75
15	Debt Redemption Reserve	3,556.94	504.16	3,556.94	504.16	3,556.94
16	Debt Service Coverage Ratio	0.05	0.07	0.23	0.19	0.17
17	Interest Service Coverage Ratio	1.49	1.96	1.54	1.71	1.55

- Exceptional and / or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind AS Rules / AS Rules, whichever is applicable.

Notes:

- The aforesaid audited financial results for the year ended March 31, 2025 have been prepared and approved by the Board of Directors at its meeting held on May 02, 2025 in accordance with Regulation 52 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended (the "Listing Regulations"). The said results have been audited by the statutory auditors of the Company, who have issued an unmodified report thereon.
- The said financial results have been prepared in accordance with the recognition and measurement principles laid down in the Indian Accounting Standard 34 "Interim Financial Reporting" (Ind AS 34) prescribed under Section 133 of the Companies Act, 2013 and other accounting principles generally accepted in India and in compliance with Regulation 52 of the Listing Regulations read with operational circular for listing obligation and disclosure requirement dated July 29, 2022 (updated as on December 1, 2022).
- The above is an extract of the detailed format of financial results filed with the BSE Limited under regulation 52 of the Listing Regulations. The full format of the financial results is available on the websites of the BSE Limited at www.bseindia.com and the Company at www.jmfinancialservices.in.
- For the other line items referred in regulation 52 of the Listing Regulations, as amended have been submitted to the BSE Limited and can be accessed on www.bseindia.com and on the website of the company i.e. www.jmfinancialservices.in.

For and on behalf of the Board of Directors

JM Financial Services Limited

Sd/-

Nirav Gandhi
Whole-Time Director
DIN: 08778702

Place: Mumbai

Date: May 02, 2025

સુરતમાં ફિલ્મી ટબે લૂંટનો પ્રયાસ, લાઈટર બંધૂકની અણીએ વૃદ્ધાને લૂંટવા આવ્યો

સચિન વિસ્તારમાં ઘોળા દિવસે લૂંટની ઘટના બનતા ટળી હતી



● સુરત, તા. ૪

સચિન વિસ્તારમાં ઘોળા દિવસે લૂંટની ઘટના બનતા ટળી હતી. વૃદ્ધ દંપતીની હિંમત અને આસપાસના લોકોની સહકર્તાના કારણે લૂંટ કરવા આવેલ શખ્સને ઝડપી પડાયો હતો. જે આરોપીની સચિન પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

સચિન પોલીસના જણાવ્યાનુસાર, સચિન ગામમાં અરુણ વાંસિયા અને તેમના પત્ની નીરમતી વાંસિયા સહપરિવાર જોડે રહે છે. શુક્રવારના રોજ બપોરના દોઢ વાગ્યાના સમયે બંને પતિ-પત્ની ઘરમાં હાજર હતા, તે વેળાએ અજાણ્યો એક શખ્સ ઘરમાં આવી ચઢ્યો હતો. પોતે કુરિયર કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી વૃદ્ધ દંપતીના

નામે કુરિયર હોવાનું જણાવી ઘરમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ અકાએક પોતાની પાસે રહેલ બંદૂક જેવા હથિયારની નોક પર વૃદ્ધ દંપતીને બંધક બનાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘરમાં વૃદ્ધ દંપતી સહિત અન્ય એક યુવતી હાજર હતી. જે શખ્સ પાસે રહેલ બંદૂક જેવા હથિયારને જોઈ વૃદ્ધ દંપતી સહિત યુવતી ગભરાઈ હતી.

દરમ્યાન વૃદ્ધ આરોપીનો પ્રતિકાર કર્યો હતો. જે સમયે આરોપી દ્વારા વૃદ્ધને સોફા પર ધકોઠા મારી બેસાડી દેવામાં આવ્યો હતો. વૃદ્ધા દ્વારા બુમાબુમ કરતા ભારે હોબાળો મચી ગયો હતો. જ્યાં ગભરાય ગયેલ શખ્સ ત્યાંથી ભાગી રહ્યો હતો. પોતે કુરિયર કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી વૃદ્ધ દંપતીના

ઝાલોદના દાહોદ રોડ પર થયેલા ગેરકાયદેસર બાંધકામના મામલે

પરવાનગીના કાગળો રજૂ કરવા ચીફ ઓફિસરની નોટીસ ફટકારી

● દાહોદ, તા. ૪

ઝાલોદ સુંદરમ હોસ્પિટલની બાજુમાં બાંધકામની મંજૂરીના નિયમોનું લંઘન કરી કાયદાની એસી તેસી કરી મનસ્વી રીતે કોમન પાર્કિંગના એરિયામાં દુકાનોનું બાંધકામ કરી, આ મામલે ઝાલોદ પાલિકા ચીફ ઓફિસરે આપેલ નોટિસનો કોઈ પ્રત્યુત્તર ન આપી નોટિસની એએસીતેસી કરતા ચીફ ઓફિસરે આ મામલે આખરી નોટિસ આપી દિન-૩ માં બાંધકામની પરવાનગીના સાધનિક કાગળો અંગ્રેની કચેરીએ તાત્કાલિક રજૂ કરવા જણાવતા ઝાલોદ નગરમાં આવા ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્કાલી ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે. ઝાલોદનગરના દાહોદ રોડ પર સુન્દરમ હોસ્પિટલની બાજુમાં આવેલ સીટી સર્વે નંબર ૩૨૮૮ માં રહેણાંક તથા કોમર્શિયલ હેતુ માટે ઝાલોદ નગરના રામચંદ્ર યુનીલાલ પ્રજાપતિ દ્વારા બાંધકામની મંજૂરી માટે રજૂ કરવામાં આવેલ પ્લાનમાં ૪૨૮.૮ ચોરસ મીટર ડ્રાઉઇંગ ફ્લોર પર કોમન પાર્કિંગ એરિયા બતાવવામાં આવેલ છે. પરંતુ બાંધકામની મંજૂરી માટે રજૂ કરવામાં આવેલા પ્લાન મુજબ બાંધકામ ન થયું હોવાનું જાણવા મળતા, ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્થળ તપાસ કરી ખાતરી કરતા રામચંદ્ર યુનીલાલ પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલ બાંધકામમાં કોઈપણ પ્રકારનો



પાર્કિંગ એરિયા હોય તેવું જણાતું ન હોઈ તેઓએ બાંધકામની મંજૂરીના નિયમોનું ઉલ્લંઘન કરી મનસ્વી રીતે ગેરકાયદેસર બાંધકામ કરેલ છે. તેવું જણાઈ આવતા તે સંદર્ભે તારીખ ૨૫-૪-૨૦૨૫ ના રોજ ગુજરાત નગરપાલિકાના ચીફ ઓફિસરે ઝાલોદના રામચંદ્ર યુનીલાલ પ્રજાપતિને નોટિસ પાઠવી જાણ કરી બાંધકામની પરમિશનના જરૂરી દસ્તાવેજ લઈ અંગ્રેની કચેરીએ પૂર્તતા કરવા જણાવ્યું હતું. પરંતુ રામચંદ્ર યુનીલાલ પ્રજાપતિએ આજ દિન સુધી ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે આપવામાં આવેલ નોટિસનો ખુલાસો કર્યો નથી. જે ઘણી ગંભીર બાબત છે. તે માટે વધુમાં ઉપરોક્ત રહેણાંક તથા કોમર્શિયલ હેતુ માટે બાંધકામ માં અંગ્રેની કચેરીના તથા

અન્ય કોઈ બાંધકામ પરવાનગી લેવામાં આવેલ હોય તો તે બાંધકામ પરવાનગીના સાધનિક કાગળો દિન-૩ માં તાત્કાલિક રજૂ કરવા ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તારીખ ૨૫-૪-૨૦૨૫ ના રોજ ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૮૯૩ ની કલમ ૧૫૫ ની જોવાઈ અનુસાર આખરી નોટિસ આપવામાં આવી છે. જો તેમ કરવામાં કસુર કરશે તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૮૯૩ ની કલમ ૧૫૫ ની જોવાઈ અનુસાર આ ડ્રાઉઇંગ ફ્લોરનું બાંધકામ તોડી પાડવા માટે અપવામાં આવેલ રહેશે. અને આ બાબતે કોઈ નુકસાની અથવા કોઈ પણ જવાબદારી ઊભી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે. તેમ નોટિસમાં જણાવાયું છે.

સુરતની મોડલના આપઘાત કેસમાં નવો વળાંક

સુરતની મોડલ લિવ ઈનમાં રહેતી હોવાની નવી થીયરી આવી સામે આવ્યું

૧૯ વર્ષીય મોડલનો ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો

● સુરત, તા. ૪

સુરતમાં ૧૯ વર્ષીય મોડલ યુવતીના આપઘાતનું રહસ્ય ઘેરોઈ રહ્યું છે. યુવતીએ વીડિયો કોલ ચાલુ રાખી ફાંસો ખાધો હોવાની શંકા છે. તેના પિતાએ કહ્યું કે, તેમને બે યુવક અને યુવતી પર શંકા છે. તેઓએ બબલીએ મારી નાખવાની ધમકી આપી હતી. તો બીજી તરફ, યુવતી લિવ ઈન રિલેશનશિપમાં રહેતી હોવાની અટકળો છે.

મૂળ મધ્યપ્રદેશ અને સારોલી કુંભારિયા ગામમાં આવેલા સારોલી રેસીડેન્સીના D 304 ઘરમાં PG રહેતી ૧૯ વર્ષીય સુખપ્રીત લખવિંદરસિંહ કોર અન્ય ત્રણ ભદેનપણી સાથે રહેતી હતી અને તેનો પરિવાર વતનમાં રહે છે. સુખપ્રીત મોરેલિંગનું કામ કરતી હતી. સુખપ્રીતની સાથે રહેતી તેની ભદેનપણીઓ પણ મોરેલિંગનું કામ કરે છે. સુખપ્રીત ચાર-પાંચ દિવસ પહેલા જ સુરતના સારોલી ખાતે મોરેલિંગનું કામ અર્થે આવી હતી. ત્યારે ગતરોજ અચાનક

સુખપ્રીતે ઘરે બેઠડરૂમમાં છતમાં લગાવેલ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ભદેનપણી ઘરે આવતા સુખપ્રીતને લટકેલી હાલતમાં જોતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.

મધ્યપ્રદેશની મોરેલિંગ કરતી સુખપ્રીત કોર સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓનું મોરેલિંગ શુટ કરતી હતી. ગતરોજ તેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સુરતની મોડલ સુખપ્રિત કોરના આપઘાત બાદ તેના પરિવારજનો સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. ત્યારે પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મોડલે આપઘાત કર્યો તેના એક દિવસ પહેલા જ વીડિયો કોલ પર પરિવાર સાથે વાત કરી હતી. સુખપ્રીતને કામના પેમેન્ટ અન્ય કોઈ વ્યક્તિ લઈ રહ્યું હોવાની પરિવારને આશંકા છે. દિલ્હીનો કોઈ યુવક સુખપ્રીતને કામનું છે. પેમેન્ટ મળતું હતું તે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હતો.

આપઘાત પાછળ પરિવારને કેટલાક વ્યક્તિ પર શંકા ઉપજી છે. દિલ્હીના એક અનુરાગ કરીને યુવક પર પરિવારને આશંકા છે. આપઘાત પહેલા તેણે આ યુવક સાથે વાત કરી હોવાની પરિવારના શંકા છે. સુખપ્રીતે સુરત આવા પહેલા દિલ્હી ખાતે મોરેલિંગનું કામ કર્યું હતું અને તેનું પેમેન્ટ પણ તે આપતો ન હતો અને ત્યારબાદ હવે તે ફોન પણ ઉચકતો નથી. આ ઉપરાંત એમપીનો એક અન્ય વ્યક્તિ સાથે જ તેની સાથે કામ કરતી બબલી નામની યુવતી પણ અવારનવાર તેને ધમકી આપતી હતી જેને લઈ પરિવારને આ ત્રણ ઉપર શંકા છે જેની વિગત પણ પોલીસને તેમણે જણાવી છે.

તો બીજી તરફ, મોડલ કોઈ સાથે લિવ ઈનમાં રહેતી હોય તેવી શંકા પણ છે, તેથી આ બાબતે પોલીસ તપાસ કરશે. હાલ મોડલની સાથી યુવતીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. મોડેલના બે મોબાઈલ કબ્જે કરી FSL માં મોકલવામાં આવશે.

વાવાઝોડાએ કંગાળ કર્યા! ૫૦૦ ઝાડ પરથી કેસર કેરી ખરી પડી

● બનાસકાંઠા, તા. ૪

અનેક વિસ્તારોમાં મોડી રાત્રે ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઉનાળું પાકને નુકસાન પહોંચાડ્યું છે. પાલનપુરમાં પડેલા પવન સાથેના કમોસમી વરસાદથી ૫૦૦ કેસર કેરીના આંબાવાડીમાં રહેલા આંબાના ઝાડ પરથી ભારે પવનના કારણે કેરીઓ પડી જતા આંબાની વાડી

ઉધડ રાખનાર વ્યક્તિને મોટું નુકસાન પહોંચતા સરકાર પાસે સહાયની માંગ કરાઈ છે. હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠાના થરાદ,ડીસા,ધાનેરા,દાંતીવાડા, અમીરગઢ, વડગામ અને પાલનપુરમાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના બાજરી,જુવાર પાકોને નુકસાન

પહોંચ્યું છે. પાલનપુરમાં પડેલા ભારે પવન સાથેના વરસાદે આંબાવાડીમાં ઉભેલા ૫૦૦ કેસર કેરીના ઝાડ ઉપરથી કેરીઓ નીચે પાડી દેતા આંબાવાડી ઉધડ રાખનાર વિશાલભાઈ પટનીને મોટું નુકસાન પહોંચ્યું છે.વિશાલ પટનીનું કહેવું છે કે “અમે ૮ લાખ રૂપિયા આપીને ૫૦૦ કેસર કેરીના આંબા ઉધડ રાખ્યા હતા અને અમને આશા

હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં અચાનક પલટો

કડાણ-સંતરામપુરપંથકમાં માવહુ વીજળી પડવાથી બે ભેંસના મોત



● લુધાવાડા, તા. ૪

મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રાત્રિ દરમિયાન સંતરામપુર અને કડાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. કડાણ તાલુકાના ડીટવાસ ગામમાં વીજળી પડવાથી વૃક્ષ નજીક બાંધેલી બે ભેંસના મોત થયા છે. આ ઘટનાથી ખેડૂત પરિવાર પર મોટો આર્થિક બોજ પડ્યો છે. સંતરામપુર શહેર અને આસપાસના

વિસ્તારોમાં વહેલી સવારે પવન સાથે હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદને કારણે રસ્તાઓ ભીના થયા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વરસાદથી લોકોને રાહત મળી છે.

મહીસાગર જિલ્લાના કડાણ તાલુકામાં આવેલા ગુજરાત-રાજસ્થાન સરહદ વિસ્તારના ગામોમાં ગતરોજ વરસેલા તીવ્ર કમોસમી વરસાદના કારણે ખેતીના પાકો સહિત પશુઓ માટેના ઘાસચારાને પણ નુકસાન પહોંચ્યું છે. કડાણના ગોધર ગામે ખેતરમાં રહેલા મકાઈના પુળા પલળી ગયા છે.

હાલોલ શહેરના કરીમ કોલોની ખાતે કરતલા ચોકમાં

ખુલ્લા પ્લોટમાં રાખેલી પ્લાસ્ટિકની કેરેટોમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ



● હાલોલ, તા. ૪

હાલોલ શહેરમાં કર્મના વિસ્તાર નજીક આવેલ કરીમ કોલોની ખાતે આવેલ કરતલા ચોકમાં રહેણાંક મકાનોની વચ્ચે એક ખુલ્લો પ્લોટ આવેલો છે જે પ્લોટમાં ફૂટ અને શાકભાજી ભરવા માટે વપરાતી પ્લાસ્ટિકની ખાલી કેરેટો જથ્થો મુકવામાં આવેલો હતો જે ખુલ્લા પ્લોટમાં મુકવામાં આવેલ પ્લાસ્ટિકની કેરેટોના જથ્થામાં કોઈક કારણોસર એકાએક આગ લાગવાની ઘટના સર્જાઈ હતી જેમાં આ ખુલ્લા પ્લોટમાં મુકેલા પ્લાસ્ટિકની કેરેટોમાં લાગેલી આગે જોતે જોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા આગની વિકાસ જવાળાઓ ઊંચે સુધી ઉઠવા પામી હતી અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડવા પામતા રહેણાંક વિસ્તારમાં આગ લાગવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય સાથે ગભરાટનો માહોલ

ફેલાયો હતો આ ખુલ્લા પ્લોટમાં લાગેલી ભીષણ આગને પગલે આ પ્લોટની પાછળ આવેલા એક રહેણાંક મકાનના પેહલા માળે આવેલી બારી સુધી આગની જવાળાઓ પહોંચતા અને આગની જવાળાઓ બારીમાં રહી પેહલા માળે રૂમમાં પ્રવેશતા પેહલા માળે રૂમમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં પ્લોટમાં લાગેલી આગે બાજુના મકાનને પોતાની અડપટમાં લેતા આ વિસ્તારમાં આગની ઘટનાને પગલે વધુ ભય અને ગભરાટનો માહોલ ફેલાયો હતો જોકે બનાવ અંગેની જાણ તાત્કાલિક હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરને કરવામાં આવી હતી જેમાં ફાયર ફાઈટરની ટીમના લાકરો અગ્નિશામન વાહનો સાથે તાબકતોડ ઘટના સ્થળે દોડી આચ્યા હતા અને વિકરાળ આગ પર સતત પાણીનો મારો ચલાવી આગને ઓલવવાની કોશિષમાં જોડાયા હતા.

છોટાઉદેપુર ખાતેથી ચોરાયેલ

કારના ગુનાનો ભેદ

ઉકેલાયો : શપ્સ ઝડપાયો

● બોડેલી, તા. ૪

છોટાઉદેપુર ટાઉન વિસ્તારમાં કોઈ અજાણ્યા ઈસમે કરીયાદીની માડૂની સુલુકી કંપનીની ઈકો ગાડી જેનો ની ચોરી કરી લઈ ગયેલ જે અંગે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો જે ગુનો પ્રથમથી જ વણસોધાયેલ હતો. જીલ્લાના તમામ થાણા ઈન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અનુસંધાને છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એ.આર.પ્રજાપતિ નાઓના માર્ગદર્શન હેઠળ હયુમન સોર્મોગિ અને ટેકનીકલ સર્વેલન્સ ટીમ દ્વારા અલગ અલગ દીક્ષામાં તપાસ કરતા હકીકત જણાય આવેલ કે ઉપરોક્ત ગુનામાં ચોરી થયેલ ઈકો ગાડી છોટાઉદેપુર ટાઉન વિસ્તારમાં રહેતા અલતાફ ભાઈ નાઓએ ઈકો ગાડી ચોરી કરી હોવાની માહિતી સ્થળા ગાડી ચોરનાર ઈસમને પોલીસ સ્ટેશન લાવી ઉડાણપુર્વક તપાસ કરતા ઈસમે ઈકો ગાડી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ અને ઈકો ગાડી ગોધરા ખાતે કોઈ વિસ્તારમાં સંતાડી મુકી રાખેલ છે. જે આધારે ઈસમને સાથે રાખી ગોધરા કોટી વિસ્તારમાંથી ઈકો ગાડી કબ્જે કરવામાં આવેલ જે ઈકો ગાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન લાવી આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા અનડીટેક્ટ વાહન ચોરી ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ડીટેક્ટ કરવામાં આવેલ છે.

સુરતના દેવધ ગામ ખાતે આહિર શૈક્ષણિક ભવન દ્વારા ભવ્ય સ્નેહ સમારોહનું આયોજન કરાયુ

માયાભાઈ આહિરને નેતાઓએ રૂપિયાથી નવડાવી દીધા, ડાયરાના સ્ટેજ પર રૂપિયાનો પથારો થઈ ગયો

રૂપિયાનો એટલો વરસાદ કરાયો કે આખો સ્ટેજ ભરાઈ ગયો હતો

● સુરત, તા. ૪

સુરતના દેવધ ગામ ખાતે આહિર શૈક્ષણિક ભવન દ્વારા ભવ્ય સ્નેહ સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં જાણીતા લોકકલાકાર માયાભાઈ આહીરના યોજાયેલા લોકડાયરામાં નેતાઓના રૂપિયાનો વરસાદ કર્યો હતો.આહિર શૈક્ષણિક ભવન દ્વારા સ્નેહ સમારોહ અને માયાભાઈના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેતાઓ દ્વારા માયાભાઈ આહીર પર રૂપિયાનો વરસાદ કરાયો હતો. રૂપિયાનો એટલો વરસાદ કરાયો કે આખો સ્ટેજ ભરાઈ ગયો હતો. તો બીજી તરફ, આહિર શૈક્ષણિક ભવન સુરતના ભૂમિદાતા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આગેવાનો સહિત અનેક આહીરોએ લાખો રૂપિયાના દાનની જાહેરાત કરી હતી. માયાભાઈના લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમ સ્થળે અંદાજે ૨૫ હજારથી વધુ લોકોની હાજરી નોંધાઈ



હતી. જેમાં સમાજના પ્રતિષ્ઠિત વર્ગના લોકો, સરકારી અધિકારીઓ તથા અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. થોડા સમય પહેલા મહેસાણાના જુલાસણમાં ડાયરાના કાર્યક્રમ પહેલા માયાભાઈ આહીરની તબિયત લથડી હતી. જુલાસણ ગામે અનુપમ પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમને લઈ ડાયરાનું આયોજન કરાયું હતું. પરંતુ ડાયરા પૂર્વ માયાભાઈ આહીરને છાતીમાં દુખાવો ઉપ્પયો હતો. તબિયત ખરાબ હોવા છતાં ચાહકો

માટે સ્ટેજ પર પહોંચ્યા હતા, પરંતુ ડાયરાની શરૂઆતમાં સ્તુતિ ગાયા બાદ તેમની તબિયત લથડી હતી. જેથી તેમને તાત્કાલિક અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા. જેના બાદ માયાભાઈ આહીરના સમાચાર મળતા જ તેમના ચાહકવર્ગમાં ચિંતા વ્યાપી ગઈ હતી. અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ આહીરને છાતીમાં દુખાવો ઉપ્પયો હતો. તબિયત ખરાબ હોવા છતાં ચાહકો

સુરેન્દ્રનગરમાં અનિચ્છનીય ઘટના બની

સીમા હૈદરને મારવાનો કર્યો પ્રયાસ! “સીમા અને સચિને મારી પર કાળો જાદૂ કર્યો છે”

● સુરેન્દ્રનગર, તા. ૪

રાષ્ટ્રીય રાજધાનીને અડીને આવેલા ગ્રેટર નોઈડાના રાખુપુરામાં રહેતી પાર્કિસ્ટાની નાગરિક સીમા હૈદર સાથે અનિચ્છનીય ઘટના બની છે. એક અજાણ્યો યુવક બળજબરીથી તેના ઘરમાં ઘૂસી ગયો અને સીમા હૈદરનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો, અને તેને ત્રણ-ચાર વાર થપ્પડ પણ મારી દીધા. સીમા હૈદરે બુમાબુમ કરી જેને સાંભળીને તેના પરિવાર અને નજીકના લોકો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા. આ લોકોએ મળીને આરોપી યુવકને પકડી લીધો અને તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી. આ યુવાન ગુજરાતી હોવાનું સામે આવ્યું છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આરોપીની ધરપકડ કરી અને કેસની તપાસ શરૂ કરી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ ચોકવાનારું નિવેદન આપ્યું છે. તેણે દાવો કર્યો છે કે, સીમા હૈદર અને સચિને તેના પર કાળો જાદુ કર્યો છે. પોલીસ આ દાવાની પણ તપાસ કરી રહી છે.



આ ઘટના શનિવારે મોડી સાંજે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે આરોપી બળજબરીથી ઘરમાં ઘૂસી ગયો, ત્યારે સીમા હૈદરે તેનો વિરોધ કર્યો, જેના પર આરોપીએ તેને થપ્પડ મારી. અવાજ સાંભળીને પરિવાર અને પડોશીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પહેલા આરોપીને પકડી લીધો અને માર માર્યો અને પછી પોલીસને સોંપી

પોલીસને બહાર જોવાનો પ્રયાસ કર્યો. દરમિયાન, આરોપીએ ઝડપથી સીમા હૈદરનું ગળું પકડીને તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો. આ ઘટના એવા સમયે બની છે જ્યારે પોલીસે માનસિક રીતે અસ્વસ્થ છે. પોલીસે આરોપીના પરિવારને તેની ધરપકડ અંગે જાણ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ અનુસાર, આ કેસની સંપૂર્ણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે, આરોપીના મોબાઈલ ફોનની કોલ રિટેલ્સ પણ તપાસવામાં આવી રહી છે જેથી તેના અહીં આવવાનો હેતુ અને અન્ય કોઈ સંબંધિત સંડોવણી જાણી શકાય.



VOLTAMP
VADODARA
THE POWER OF INDUSTRY

Registered office : Makarpura, Vadodara – 390014, Gujarat.
CIN : L31100GJ1967PLC001437
Tel: 0265 6141403 / 6141480 / 3041480 | Email: sanket_act@voltamptransformers.com
Website: www.voltamptransformers.com

EXTRACT OF STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2025

(Rs.in Lakhs)						
Sr. No.	Particulars	Quarterended 31/03/2025 (Audited)	Quarterended 31/12/2024 (Unaudited)	Quarterended 31/03/2024 (Audited)	Year ended 31/03/2025 (Audited)	Year ended 31/03/2024 (Audited)
1	Total income from operations (net)	62481.43	48352.28	50415.98	193423.03	161622.27
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	12933.80	10217.42	11938.10	43630.31	39787.65
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	12933.80	10217.42	11938.10	43630.31	39787.65
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	9682.55	7340.24	9352.94	32541.32	30736.07
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	9667.68	7333.46	9288.27	32506.12	30708.96
6	Paid up Equity Share Capital (face value of Rs.10 each)	1011.71	1011.71	1011.71	1011.71	1011.71
7	Reserves (excluding Revaluation Reserve)	----	----	----	157750.30	134349.59
8	Earnings Per Share (not annualised)					
	Basic :	95.70	72.55	92.45	321.65	303.80
	Diluted :	95.70	72.55	92.45	321.65	303.80

Notes:-

- The above audited results for quarter and year ended March 31, 2025 have been reviewed by the Audit Committee and approved by the